

મહાત્મા ગાંધી સ્વચ્છતા અભિયાન

પ્રિય મિત્રો,

આપ જાણતાજ હશો કે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ સ્તરે ભારતની ઉમદા છબીને ઉજાગર કરવાના હેતુસર સ્વચ્છ ભારત અભિયાનની ગુંબેશ હાથ ધરી છે, જે અંતર્ગત દરેક ભારતીયને સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાવા અપીલ કરવામાં આવેલ છે.

ગુજરાત સરકારશ્રી તેમજ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડના માર્ગદર્શન હેઠળ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ માનનીય વડાપ્રધાન શ્રીના આ સ્વપ્નને સાચા અર્થે સાર્થક બનાવવા કટિબદ્ધ છે.

મિત્રો, મહાત્મા ગાંધીએ એક એવા ભારતનું સ્વપ્ન જોયું હતું, જેમાં સ્વચ્છતા અને સ્વસ્થતાને પ્રાથમિકતા હોય. તો આવો આપણે સૌ સાથે મળીને આજ રોજ તા.૦૨-ઓક્ટોબર-૨૦૧૪ ના રોજ એ વચન લઈએ કે આપણે સૌ :-

- કંપનીની દરેક કચેરી તથા કચેરી પરિસરને સાફ-સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરીશું અને કચરો કચરા પેટી માંજ નાખીશું.
- જો કોઈ પણ કચેરી કે કચેરી પરિસરમાં કચરો બહાર ક્યાય પડેલો દેખાય, તો દરેક અધિકારી-કર્મચારી પોતાની નૈતિક ફરજ સમજીને આ કચરાને ઉઠાવીને કચરા પેટીમાં નાખશે.
- દરેક કચેરી ખાતે નિયમિતપણે હાઉસ-કીપિંગનો પુરતો ખ્યાલ રાખીશું.
- તમામ ફાઈલ-ફોલ્ડર-દસ્તાવેજ-રેકોર્ડ્સ તથા અન્ય જરૂરી કાગળોને ગમે ત્યાં છુટા ના ફેકતા યોગ્ય રીતે મુકીશું.
- દરેક કચેરી પરિસરમાં જ્યાં પણ ઝાડ-પાન હોય, ઘાસ હોય, ત્યાં યોગ્ય રીતે સાફ-સફાઈ તથા જરૂરી સમારકામ કરીશું તથા ફૂલ-છોડ વાવીને નિયમિત સંભાળ રાખીશું.
- દરેક કચેરીએ ગટર તેમજ પાણી નિકાલની વ્યવસ્થાનું સમયાંતરે ધ્યાન રાખીશું, કે જેથી ક્યાય ગંદગીનો પ્રભુ ઉભોજ ના થાય.
- દરેક વિભાગીય લેબોરેટરીમાં મીટર સ્ટેકીંગ વ્યસ્થિત રીતે થાય તેની કાળજી લઈશું.
- દરેક આર.એસ.ઓ. ખાતે તમામ મટીરીયલને યોગ્ય રીતે ગોઠવીને મુકીશું.

તો આવો મિત્રો, આપણે સૌ સાથે મળીને આ અભિયાનને સફળ બનાવીએ...

મેનેજીંગ ડીરેક્ટર

ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ